

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટનવાસીઓને ઓક્ટોબર 2022 નાં મ્યુનિસિપલ ઈલેક્શનમાં કામ કરવાની હાકલ કરવામાં આવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 16, 2022) – તા. જૂન 17 થી શરૂ કરીને, જાહેર જનતામાંથી કોઈપણ વ્યક્તિ મ્યુનિસિપલ ઈલેક્શન વર્કર બનવા અને મતદાન દિવસ, તા. ઓક્ટોબર 24 નાં રોજ વહીવટી અને ગ્રાહક સેવા કામગીરીઓમાં સહાયતા કરવા અરજી કરી શકે છે. 2,000 થી વધારે પદો ઉપલબ્ધ છે. ચડિયાતી પસંદગી 18 કે વધારે વર્ષની ઉંમરના બ્રેમ્પટનવાસીઓની કરવામાં આવશે.

આ નવી આવડતો કેળવવાની, આ શહેરના મ્યુનિસિપલ કર્મચારીગણને ઓળખવાની અને તમારા સમુદાય સાથે જોડાવાની એક મોટી તક છે. સંખ્યાબંધ પદો ઉપલબ્ધ છે અને કામનું વિગવતાર વર્ણન જૂન 17 થી ઓનલાઇન અહીં [www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes) પર ઉપલબ્ધ થશે.

રવિવાર, જૂન 19 નાં રોજ ગાર્ડન સ્ક્વેરમાં ગૌરવવંતું આયોજન કરતી ઈલેક્શન ટીમની મુલાકાત લો! લોર્ના બિસેલ ફાઉન્ટેઇન સામે સ્થિત મ્યુનિસિપલ ઈલેક્શન કિયોસ્કની મુલાકાત લેશો, કર્મચારીગણ પાસેથી તમારા પ્રશ્નોના જવાબ મેળવો અને સ્થળ પર તરત જ અરજી કરો.

### ઝડપી માહિતી

- રસ ધરાવતી વ્યક્તિઓ તા. જૂન 17 થી શરૂ કરીને ઓનલાઇન અરજી અહીં [www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes) પર કરી શકે છે.
- તા. જૂન 17 થી અરજીની છાપેલી નકલો અહીંથી મેળવી શકાશે: The City Clerk's Office, City Hall, 2 Wellington Street West
- સીટી ક્લાર્કની ઓફિસ અઠવાડિક કામકાજના દિવસોમાં સવારે 8:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે
- નિયુક્તિ પામેલી વ્યક્તિઓને સપ્ટેમ્બર 2022 માં જાણ કરવામાં આવશે, અને વર્ગમાં હાજર રહેવાની અને વાંચન સાહિત્યની સમીક્ષા કરવા સહિત, બેથી ત્રણ કલાકની તાલીમ ઓક્ટોબર 24 પહેલાં મેળવવાની જરૂર પડશે, અને આ વ્યક્તિઓ ઓક્ટોબર 24 નાં રોજ 14 કલાક સુધી કામ કરશે.
- એડવાન્સ વોટિંગ માટેના પદો પણ ઉપલબ્ધ છે. એડવાન્સ વોટિંગ ઓક્ટોબર 7, 8, 9, 14 અને 15 નાં રોજ યોજાશે.
- તાલીમ અને વળતર પૂરું પાડવામાં આવશે.
- ભૂતપૂર્વ અનુભવ અને કોમ્પ્યુટરની આવડતો ધરાવતી વ્યક્તિ ચડિયાતી પસંદગી પામશે.

### અવતરણ (ક્વોટ):

“પાત્રતા ધરાવનાર 350,000 થી વધારે મતદાતાઓની સંખ્યા સાથે, મ્યુનિસિપલ ઈલેક્શન અસરકારક રીતે કરાવવામાં ચૂંટણી કાર્યકરોની સહાયતા નિર્ણાયક બને છે. કંઈક સેવા આપવાની ભાવના ધરાવતી કોઈપણ વ્યક્તિ અરજી કરવા આવકાર્ય છે. તમે ભલે મ્યુનિસિપલ સરકાર વિશે વધુ જાણવા ઈચ્છતા વિદ્યાર્થી, બ્રેમ્પટનમાં સ્થાનિક અનુભવ મેળવવા આતુર નવા આગતુક, અથવા તમારા સમુદાયને કંઈક પરત આપવા ઈચ્છતા રહેવાસી એમ ગમે તે હો, તમારા માટે આ એક તક રહે છે!”

- પીટર ફે (Peter Fay), સીટી ક્લાર્ક અને રિટર્નિંગ ઓફિસર (ચૂંટણી અધિકારી), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)